

ISO 9001:2015 Certified







16<sup>th</sup> February, 2023

To,

**Bombay Stock Exchange Limited** 

Corporate Relationships Department 1<sup>st</sup> Floor, New Trading Ring,

Rotunda Building,

Phiroze Jeejeebhoy Towers, Dalal Street,

Mumbai - 400 001 **BSE CODE: 523792**  National Stock Exchange of India Limited

Exchange Plaza, C-I, Block G,

Bandra Kurla Complex,

Bandra (E)

Mumbai - 400 051

**NSE CODE: MAZDA** 

Subject: Newspaper Advertisement pertaining to Unaudited Financial Results for the Quarter ended on 31st December, 2022

Dear Sir,

Pursuant to Regulation 33 read with regulation 47(3) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper publication of the extract of the Standalone Unaudited Financial Results of the company for the third quarter ended on 31st December, 2022, published in English and Gujarati language newspaper "Financial Express" on 15<sup>th</sup> February, 2023.

Please take note of the same.

Thanking you

Yours faithfully For Mazda Limited

Nishith Kayasth **Company Secretary** 

Encl: As above

## BAKERI URBAN DEVELOPEMENT PVT. LTD.

NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2022

'Sanskrut", Nr. Old High Court Road, Off Ashram Road, Ahmedabad 380009. Tel: 91-79 40001300 Fax: 91-79-40001399. e-mail: info@bakeri.com Website: www.bakeri.com

UNAUDITED CONSOLIDATED STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND

CIN No.: U70100GJ1996PTC030783



(Rs. In Lakhs)

SI. No	Particulars	Quarter ended Dec., 31, 2022 (Unaudited)	Quarter ended Sept., 30, 2022 (Unaudited)	Quarter ended Dec., 31, 2021 (Unaudited)	9 months ended Dec., 31, 2022 (Unaudited)	9 months ended Dec., 31, 2021 (Unaudited)	Year ended March 31, 2022 (Audited)	
(1)	Total Income from Operations	1,505.78	(764.32)	1,556.35	1,998.92	3,493.73	4,591.34	
(2)	Net Profit/(Loss) for the period before Tax and exceptional items	623.02	(596.38)	(63.21)	84.47	(198.37)	(351.94)	
(3)	Net Profit/(Loss) for the period after tax	623.04	(596.38)	(63.21)	84.49	(233.48)	(387.80)	
(4)	Net Profit/(Loss) for the period after tax (After Non Controlling Interest)	587.72	(593.85)	(77.13)	50.51	(243.49)	(389.67)	
(5)	Total earning including Other Comprehensive Income for the period	623.04	(596.38)	(63.21)	84.49	(233.48)	(332.84)	
(6)	Total earning including Other Comprehensive Income for the period (After Non Controlling Interest)	587.72	(593.85)	(243.49)	50.51	(243.49)	(334.70)	
(7)	Paid up Equity Share Capital	1.01	1.01	1.01	1.01	1.01	1.01	
(8)	Net worth	1,397.46	774.42	(587.68)	1,397.46	(587.68)	1,312.97	
(9)	Earnings Per Share (Face value per share Rs.10/- each)	E 922 E0	(F 904 39)	(765 56)	501.37	(2.416.74)	(2.967.65)	
	1. Basic: (Rs. per share) 2. Diluted: (Rs. per share)	5,833.50 2.94	(5,894.28) (2.97)	(765.56) (765.56)	501.37 0.25	(2,416.74) (2,416.74)	(3,867.65) (1.95)	
N	ote ·							

Ahmedabad

(a) The above is an extract of the detailed format of quarterly results filed with the Bombay Stock Exchange under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the yearly financial results are available on the websites of the Bombay Stock Exchange (www.bseindia.com) and Company (www.bakeri.com.)

(b) Previous comparative period's figures have been reclassified/regrouped/restated, wherever necessary

13th February, 2023

For, Bakeri Urban Development Private Limited Asit N. Somani (Company Secretary)

# ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED (A Govt. of Assam Public Limited Company)

### **TENDER NOTIFICATION**

Assam Power District of Procurement from the prospective bidders for procurement power from Grid Connected Ground Mounted Solar PV Project to be governown from Grid Connected Ground Mounted Solar PV Project to be governown from Grid Connected Ground Mounted Solar PV Project to be governown from the prospect to Assam Power Distribution Company Limited (APDCL) invites tender The bid documents may be downloaded from www.apdcl.org or https://www.assamtenders.gov.in

Details will be available at www.apdcl.org or https://www.assamtenders.gov.in

Sd/- Chief General Manager (NRE) APDCL, Annex Building, Bijulee Bhawan, Paltanbazar, Guwahati - 1

### Please pay your energy bill on time and help us to serve you better!



સ્ટ્રેસ્ડ એસેટ્સ રીક્વરી શાખા (એસએઆરબી) ૧લો માળ, રત્ના આર્ટેમસ, ૪૨, સરદાર પટેલ નગર, ગીરીશ કોર્લ્ડ્રોક્સ ચાર રસ્તા પાસે, સમુદ્ર એનેક્ષ પાસે ઓફ. સી. જી. રોડ, એલીસબ્રીજ, અમદાવાદ

# પરિશિષ્ટ-४ (જૂઓ નિયમ ૮(૧)) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી, નીચે સહી કરનારે **ભારતીય સ્ટેટ બેંક, સ્ટ્રેસ્ડ એસેટ્સ રિકવરી શાખા**, ૧લો માળ, રતા આર્ટેમસ, ૪૨, સરદાર પટેલ નગર, ગીરીશ કોલ્ડ ડ્રિંક્સ ચાર રસ્તા પાસે, સમુદ્ર એનેક્ષ પાસે , ઓફ. સી .જુ .રોડ , એલિસબ્રિજ , અમદાવાદ-૩૮૦૦૦૬ના અધિકૃત અધિકારી तरीङे सिड्योरीटार्ध्रोशन એन्ड रिङन्स्ट्रङ्शन ओङ् झर्छनान्सियस अँसेट्स એन्ड એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ 3 સાથે વચાતી કલમ ૧૩(૧૨) હેઠળ भणेली सत्तानो उपयोग इरीने ०८/०८/२०२२ नी वारीफनी डिमान्ड नोटीस क्षरी इरीने દેવાદાર શ્રી મહેશ પેરૂમલ નાઈકરને ક્લમ ૧૩(૨) હેઠળની ડિમાન્ડ નોટીસમાં દર્શાવેલી તા. ૦૮/૦૮/૨૦૨૨ મુજબની બાકી રૂા. ૩૯,૬૮,૪૯૦/- (રૂપિયા ઓગણચાલીસ લાખ અડસઠ હજાર ચારસો નેવુ પુરા) તરીકેની રકમ અને ઉપાર્જિત વ્યાજ, પડતરો વગેરે કથિત

ડિમાન્ડ નોટીસ મળ્યાની તારીખથી દૃ૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર/જમીનદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી , તેમને અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે અહીં નીચે વર્ણવેલી મિલકતનો **સાંકેતિક કબજો** કથિત નિયમોના નિયમ ૮ સાથે વંચાતી કથિત એક્ટની ક્લમ

93(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ ૧૦**મી ફેબ્લુઆરી, ૨૦૨૩ ના રોજ લઈ લીધી છે.** ખાસ કરીને દેવાદાર/જામીનદારો અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે મિલકત સાથે કોઈપણ વ્યવહાર કરવો નહીં અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહારનો ચાર્જ **ભારતીય સ્ટેટ બેંક**ની તા. **૦૮/૦૮/૨૦૨૨ મુજબની બાકી** રૂા. ૩૯,૬૮,૪૯૦/- (રૂપિયા ઓગણચાલીસ લાખ અડસઠ હજાર ચારસો નેવુ પુરા) તરીકેની रङम् अने यूड्वणीनी तारीण सुधीना तेनी परना आगणना व्याप अने आङस्भिड ખર્ચાઓ , પડતરો , ચાર્જિસ સહિતને આધિન રહેશે .

સુરક્ષિત મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે, સરફેસી એક્ટની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

# સ્થાવર મિલકતનું વર્ણન

**શ્રી મહેશ પેરૂમલ નાઈકરના નામે** ૨જીસ્ટ્રેશન જીલ્લા અને ઉપ-જીલ્લા અમદાવાદ-૧૧ (અસલાલી) માં તાલુકા સિટીના મોજે રામોલ ખાતે સ્થિત રેવેન્થુ સર્વે નં. ૫૭૪ પૈકી ટી પી સ્ક્રીમ નું ૧૦૭ આગરે દલ્સ્સ્સામાં માપના કાઇનલ પ્લોટ નું ૪૦ પૈકી ૫૮૪૭ સો મી ખાતે સદગુરૂ સાંનિધ્ય તરીકે જાણીતી સ્કીમમાં જમીનના આશરે ૫૩.૮૧ ચો.મી. અવિભાજીત હિસ્સા સહિત બીજા માળે (પ્લાન મુજબ ૧લો માળ) ૧૪૭.૨૭ ચો.મી.(બિલ્ટ-અપ એરિયા) ાપના ફ્લેટ નં. બી-૨૦૪ તરીકેની સ્થાવર મિલકતના તે તમામ પીસ અને પાર્સલ **ચતુઃસીમાઃ પૂર્વે અથવા એ તરફઃ** ફ્લેટ નં. બી-૨૦૩, **પશ્ચિમે અથવા એ તરફઃ** માર્જિન બ્લોક્સ બી અને એ, **ઉત્તરે અથવા એ તરફઃ** ફ્લેટ નં. બી-૨૦૧, **દક્ષિણે અથવા એ તરફઃ** 

માર્જિન પછી ટી.પી.રોડ. તારીખ : ૧૦.૦૨.૨૦૨૩

અધિકૃત અધિકારી

# OIZHAL OIZHAL

# વિશાલ બેરીંગ્સ લીમીટેડ

(સીઆઇએન: L29130GJ1991PLC016005)

૨જી. કચેરી : સર્વે નં. 22/1, પ્લોટ નં. 1, શાપર મેઇન રોડ, શાપર (વેરાવળ), રાજકોટ, ગુજરાત -360002, ભારત ટેલી : +91 2827 - 252273 ઈમેલ : legal@vishalbearings.com વેબસાઇટ : www.vishalbearings.com

### **EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS** FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER 2022

Sr. No.	Particulars	Quarter Ended 31/12/2022	Quarter Ended 30/09/2022	Quarter Ended (31/12/2021)	Nine Month Ended (31/12/2022)	Ended	Year Ended (31/03/2022)
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	3597.42	3001.45	2980.94	9004.54	8080.96	10917.86
2	Net Profit before tax (PBT)	841.10	203.25	436.20	922.05	739.77	941.39
3	Net Profit after tax (PAT)	578.37	147.01	302.41	637.60	531.78	676.41
4	Total other Comprehensive Income, net of Income tax	3.81	25.51	3.64	(4.15)	46.59	47.01
5	Paid up Equity Share Capital	1079.10	1079.10	1079.10	1079.10	1079.10	1079.10
6	Reserves	2101.66	1519.17	1323.16	2101.66	1323.16	1468.21
7	Earning Per Share (Face Value Rs.10/- each) a) Basic (Rs.) b) Diluted (Rs.)	5.40 5.40	1.60 1.60	2.84 2.84	5.87 5.87	5.36 5.36	6.70 6.70

1) The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 13<sup>th</sup> February, 2023. The statutory auditors of the company have carried out limited review of the financial results for the quarter ended 31" December, 2022 and the above Financial Results are also available on our website www.vishalbearings.com and stock exchange website

2) The Above Financial Results have been prepared in accordance with the applicable Indian Accounting Standards as prescribed u/s. 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other recognized accounting practices and policies to the extent applicable.

3) SSegment reporting as per Ind AS-108 is not applicable as Company operates only in one segment i.e Manufacturing and selling of Bearing Rollers and allied activities.

વિશાલ બેરીંગ્સ લીમીટેક વતી,

એસડી/-દિલીપકુમાર ચાંગેલા મેનેજીંગ કિરેકટર

DIN: 00247302

# કોર્મ એ

સાર્વજનિક જાહેરાત (ઇન્સોલ્વન્સી અને બેન્કપ્ટસી બોર્ડ ઓફ ઇન્ડિયા (કોર્પોરેટ પર્સન માટે

સબંદાિત વિગતો

### ઇન્સોલ્વન્સી રીઝોલ્યુશન પ્રોસેસ) નિયમનો, ૨૦૧૬ ના નિયમન ૬ હેઠળ) મેસર્સ ઇલા મેટલ્સ પ્રાઇવેટ લીમીટેડના ક્રેડિટરોની જાણકારી માટે

٩.	કોર્પોરેટ દેવાદારનું નામ	મેસર્સ છલા મેટલ્સ પ્રાઇવેટ લીમીટેડ
૨.	કોર્પોરેટ દેવાદારનાં સુસ્થાપનની તારીખ	29.03.2096
з.	ઓથોરીટી જેના હેઠળ કોર્પોરેટ દેવાદાર ઇનકોર્પોરેટેડ/રજીસ્ટર્ડ છે	કંપની રજીસ્ટ્રાર, અમદાવાદ
г.	કોર્પોરેટ દેવાદારનો કોર્પોરેટ ઓળખ નંબર / લીમીટેડ લાયબીલીટી આઇડેન્ટીફીકેશન નંબર	U93090GJ2018PTC101401
ч.	કોર્પોરેટ દેવાદારની રજીસ્ટર્ડ ઓફીસ અને મુખ્ય ઓફીસ (જો કોઇ હોય તો) તેનું સરનામું	બી-૮૬, વ્રજધામ સોસાયટી, કમલાનગર, આજવા રોડ, વડોદરા, ગુજરાત-૩૯૦૦૧૯
ξ.	કોર્પોરેટ દેવાદારના સંદર્ભમાં ઇન્સોલ્વન્સી શરૂઆતની તારીખ	<b>૦૮.૦૨.૨૦૨૩</b> ( આદેશ <b>૧૩.૦૨.૨૦૨૩</b> ના રોજ મળ્યો હતો.)
9.	ઇનસોલ્વનસી રીઝોલ્યુશન પ્રક્રિયાની સમાપ્તિની અંદાજિત તારીખ	09.00.3003
۷.	વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે કાર્યરત ઇનસોલ્વન્સી પ્રોફેશનલના નામ અને રજીસ્ટેશન નંબર	શિવકુમાર મદનલાલ બસેર રજ્યરેશન નંબર : (IBBI/IPA-001/IP-P01263/2018-19/12064)
૯.	વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેસનલનું સરનામું અને ઇમેઇલ બોર્ડમાં રજીસ્ટર્ડ છે તે અનુસાર	<b>શિવકુમાર મદનલાલ બસેર</b> એ-૧૦૦૧, ઓપેરા હાઇસ, અગ્રસેન ભવન પાસે, સીટીલાઇટ સુરત-૩૯૫૦૦૭ ઇમેઇલ:shivmbaser@gmail.com
io.	વચગાળાના રીઝોલ્યુશન પ્રોફેશનલ સાથે પત્રવ્યવહાર માટેનું સરનામું અને ઇમેઇલ	શિવકુમાર મદનલાલ બસેર ડી-૨૨, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (આઇટીસી) મજુરા ગેટ, રિંગ રોડ, સુરત-૩૯૫૦૦૨. ઇમેઇલ : shiv.ila.cirp@gmail.com
١٩.	દાવાઓની સુપરતગીની છેક્ષી તારીખ	22.02.2023
ાર.	ક્રેડિટરોના વર્ગ, જો કોઇ હોય તો, કલમ ૨૧ની પેટા કલમ (છ એ) ની ધારા(બી) હેઠળ, વચગાળાના ઠરાવ પ્રોફેશનલની સહમતીથી	લાગુ નથી
ા ૩.	વર્ગમાં ક્રેડિટરોના અધિકૃત પ્રતિનિધિ તરીકે કાર્યરત ઇનસોલ્વન્સી પ્રોફેશનલસના નામો (દરેક ક્લાસદીઠ ત્રણ નામો)	લાગુ નથી.
૧૪.	(એ) સબંધિત ફોર્મ અને (બી) અધિકૃત પ્રતિનિધિઓની વિગતો ઉપલબ્ધ છે :	https://ibbi.gov.in/home/downloads https://www.ibbi.gov.in/legal-framework/updates લાગુ નથી

૨૦૨૩ ના રોજ મળ્યો હતો.) **મેસર્સ છલા મેટલ્સ પ્રાઇવેટ લીમીટેડ**ના ક્રેડિટરોને વિગત નં. ૧૦ સામે જણાવેલ સરનામાં પર ઇન્ટીમ રીઝોલ્ચશ પ્રોફેશનલને **બુદવાર, ૨૨ ફેબુઆરી, ૨૦૨૩** ના રોજ અથવા તે પહેલા પુરાવાઓ સાથે તેમના દાવાઓ સુપરત કર જાગાવામાં આવે છે

જાતે, અથવા પોસ્ટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક મંદિયમ દ્વારા પુરાવા સાથે દાવાઓ કરી શકે છે. ખોટા અને ગેરમાર્ગે દોરતા પુરાવાઓની સુપરતગી દંડને પાત્ર બનશે. સીએ આઇપી શિવકુમાર મદનલાલ બસેર આઇઆરપી– મેસર્સ છલા મેટલ્સ પ્રાઇવેટ લીમીટેડ »

ડી-૨૨૨, ઇન્ટરનેશનલ ટૂંડ સેન્ટર (આઇટીસી), મજુરા ગેટ રીંગ રોડ, સુરત-૩૯૫૦૦ આઇપી રજી. નં. : IBBI/IPA-001/IP-P-01263/2018-19/1206

ના : IBBN/PA-001/IP-P-01200/2010-1011200-આઇએફ્એ માન્યતા: ૧૨ મે, ૨૦૨૩ સુધી ઇમેઇલ: shiv.ila.cirp@gmail.com થળ : સુરત

કોટક મહીન્દા લેંક લીમીટેડ

તારીખ: ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૩

સ્થળ : શાપર, રાજકોટ

kotak રજીક્સા અ તાલાક સ્જુસ્ટર્ડ ઓફિસ : રજીકિસી, સી રશ, જી બ્લોક, બાંદ્રા કુરલા કોમ્પલેક્ષ, બાંદ્રા (પૂર્વ), મુંબઇ – ૪૦૦૦૫૧ . Kotak Mahindra Bank કોર્પોર્ટર ઓફિસ : કોટક ઇન્ફીનીટી, ઝોન–ા, ચોથો માળ, બિલ્ડીંગ નં . ૨૧, ઇન્ફીનીટી પાર્ક, ગોરેગાંવ, મુંબઇ – ૪૦ **રીજનલ ઓફીસ**ઃ કોટક મહીન્દ્રા બેંક લી., ૨૨૩–૨૨૯, સિધ્ધીવિનાયક કોમ્પલેસ, શીવરંજની, સેટેલાઇટ, અમદાવાદ – ૩૮૦૦૧૫.

કબજા નોટીસ (સિક્યુરીટી ઈન્ટરેસટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના પરિશિષ્ટ ૪ સાથે રુલ ૮ (૧) વંચાણે લેતા)

ાથી, કોટક મહીન્દ્રા બેંક લી., બેંકીંગ કંપની, બેંકીંગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ ની વ્યાખ્યામાં જેની રજીસ્ટર્ડ ઓફીસ : ૨૭ બીકેસી, સી ૨૭, જી પ્લોક, બાંદ્રા કુરલા કોમ્પલેક્ષ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૫૧ અને રીજનલ ઓફીસ : અમદાવાદ ખાતે, સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક ઓફ ફાયનાલ્સિયલ એસેટસ એન્ડ એન્ફોર્સેમ્ટર ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા ક્લમ ૧૩ (૨) હેઠળ મળેલી સત્તાની રૂએ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૯ સાથે વંચાણે લેતા માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોર્ન અંદર બાકી લેણા નોટીસમાં જણાવ્યા મુજબની રકમ ભરી જવા માટે જણાવેલ હતું. પક્ષકારો સાથે બેંકે કબજે લીધેલ ગીરવે મિલકતની વિગતો નીચે

કસ્ટમરનું નામ(ઉધારકર્તા (ઓ) / સહ-ઉધારકર્તા(ઓ) અને જામીનદાર(રો)	૧૩(૨) હેઠળની માંગણા નોટીસની તારીખ, સરફેસી એક્ટના નિયમ ૯ સાથે વંચાણે લેતા. ૨૬મ સાથે રૂપિયામાં	કબજો લીધેલ સ્થાવર મિલકતનું વર્ણન અને સિકચુરીટી ઇન્ટરેસટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના પરિશિષ્ટ ૪ સાથે રુલ ૮ (૧) વંચાણે લેતા	પ્રસાડ વાડીભ અનુ સ્ભિયાની
વ. બાલાજી ફેશન (ઉદારકર્તા) ૨. રાકેશ કુમાર મોદી (જામીનદાર) ૩. મોહન કુમાર મોદી (જામીનદાર) ૪. અરૂણા રાકેશ મોદી (જામીનદાર) ૫. ઉષા મોહન મોદી (જામીનદાર)	માંગણા નોટીસ તારીખ : ૦૯.૦૮.૨૦૨૧ રા. ૫૬,૪૦,૩૨૨.૬૧/– તા. ૦૬.૦૮.૨૦૨૧ ના રોજ, કરાર દરે ભવિષ્યનું ત્યાજ અને અવેજી વ્યાજ, આકસ્મિક ખર્ચ, શુલ્ક અને ચાર્જીસ વગેરે.	વ. દુકાન નં. ૫૦૯૮ અને ૫૦૯૯, ૫૧૦૦, ૫૧૦૧, ૫૧૦૨, ૫૧૧૬, ૫૧૧૭, ૫૧૧૮, ૫૧૧૯, ૫૧૨૦, ૫૧૨૧ અંબાજી માર્કેટ, ટિંગ ટોડ, સુરત – ૩૯૫૦૦૨, ૨. દુકાન નં. દ૧૨૨ અને દ૧૨૩, ૬૧૨૪, ૬૧૨૫, ૬૧૨૬ અંબાજી માર્કેટ, ટિંગ ટોડ, સુરત – ૩૯૫૦૦૨, ૩. દુકાન નં. એ/૫૧૦૯ અંબાજી માર્કેટ, રિંગ ટોડ, સુરત – ૩૯૫૦૦૨.	૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ પ્રત્યક્ષ કબજો
૧. બાલાજી ટ્રેન્ટ્સ પ્રા.લિ. (ઉદારકર્તા) ૨. રાકેશ કુમાર મોદી (જામીનદાર) ૩. મોહન કુમાર મોદી (જામીનદાર) ૪. અરૂણા રાકેશ મોદી (જામીનદાર) ૫. ઉષા મોહન મોદી (જામીનદાર)	માંગણા નોટીસ તારીખ : ૦૯.૦૮.૨૦૨૧ રૂા. ૧,૦૭,૧૦,૦૬૧.૮૭/– તા. ૦૬.૦૮.૨૦૨૧ ના રોજ, કરાર દરે ભવિષ્યનું વ્યાજ અને અવેજી વ્યાજ, આકસ્મિક ખર્ચ, શુલ્ક અને ચાર્જીસ વગેરે.	વ. દુકાન નં. ૫૦૯૮ અને ૫૦૯૯, ૫૧૦૦, ૫૧૦૧, ૫૧૦૨, ૫૧૧૬, ૫૧૧૭, ૫૧૧૮, ૫૧૧૯, ૫૧૨૦, ૫૧૨૧ અંબાજી માર્કેટ, ટિંગ ટોડ, સુટત – ૩૯૫૦૦૨, ૨. દુકાન નં. ૬૧૨૨ અને ૬૧૨૩, ૬૧૨૪, ૬૧૨૫, ૬૧૨૬ અંબાજી માર્કેટ, ટિંગ ટોડ, સુટત – ૩૯૫૦૦૨, ૩. દુકાન નં. એ/૫૧૦૯ અંબાજી માર્કેટ, રિંગ ટોડ, સુટત – ૩૯૫૦૦૨.	૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ પ્રત્યક્ષ ક્ળજો
૧. ગણપતિ ટેક્સટાઈલ્સ (ઉદારકર્તા) ૨. શ્રી નારાચણ પ્રસાદ મુંદ્રા (સહ- ઉદારકર્તા / જામીનદાર / માલિક) ૩. શ્રીમતી કિરણ મુંદ્રા (સહ- ઉદારકર્તા / જામીનદાર / માલિક) ૪. શ્રી અંકુર મુંદ્રા (જામીનદાર)	માંગણા નોટીસ તારીખ : ૧૦.૦૭.૨૦૧૯ રા. ૯૪,૯૬,૯૬૬,૮૫/– તા. ૦૩.૦૭.૨૦૯ ના રો૧, કરાર દરે ભવિષ્યનું વ્યાજ અને અવેજી વ્યાજ, આકસ્મિક ખર્ચ, શુલ્ક અને ચાર્જીસ વગેરે.	ફલેટ નં. ૩૦૧, અશોકા પેવેલિયન, કાપડિયા હેલ્થ ક્લબ સામે, નવી સિવિલ રોડ, સુરત – ૩૯૫૦૦૧	૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ પ્રત્યક્ષ કબજો
૧. મણીબદ્ર ફેશન (ઉદારકર્તા) ૨. વિવેક સુરાણા (જામીનદાર) ૩. રાજુદેવી સુરાણા (જામીનદાર) ૪. વિનીત સુરાણા (જામીનદાર) ૫. બજરંગમલ સુરાણા (જામીનદાર)	માંગણા નોટીસ તારીખ : ૦૯.૦૮.૨૦૨૧ રા. ૧,૩૦,૫૭,૭૭૪.૬૪/– તા. ૦૬.૦૮.૨૦૨૧ ના રોજ, કરાટ દરે ભવિષ્યનું ત્યાજ અને અવેજી વ્યાજ, આકસ્મિક ખર્ચ, શુલ્ક અને ચાર્જીસ વગેરે.	દુકાન નં. ૩૪ અને ૫૩, રેશમવાલા માર્કેટ, રિંગ રોડ, સુરત – ૩૯૫૦૦૨	૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ પ્રત્યક્ષ કબજો
<ol> <li>મોહનકુમાર મોદી (ઉદારક્તા)</li> <li>ઉષા મોહન મોદી (સહ- ઉદ્યારક્તા), 3. અરુણા રાકેશ મોદી (સલ-ઉદારક્તા), v. રાકેશકુમાર મોદી (સલ-ઉદારક્તા), v. મોહનકુમાર મોદી - એચચુએફ (જામીબદાર), s. બાલાજી ટ્રેન્ડ્સ પ્રા.લિ. (જામીનદાર), s. તિરૂપતિ ટ્રેન્ડ્સ પ્રા.લિ. (જામીનદાર)</li> </ol>	માંગણા નોટીસ તારીખ : 30.0૭.૨૦૨૧ રા. ૬,૫૮,૩૮,૮૧૨.૭૧/– તા. ૨૯.૦૭.૨૦૨૧ ના રોજ, કરાર દરે ભવિષ્યનું વ્યાજ અને અવેજી વ્યાજ, આકસ્મિક ખર્ચ, શુલ્ક અને ચાર્જીસ વગેરે.	રઘુકુલ ટેક્સટાઈલ માર્કેટ, વિંગ સી, ચોથા માળે, દુકાન નં. દ્દરભ/એ અને દુરુખ, દ્દરભ્દ, દ્દરભ્દ, દ્દરભ્ટ, દુરભ્દ, દુરુભ, દુરભ્ટ, દુરભ્દ, દુર્વભ, વિકુલ ભટ્ટ કાનો) મિલેનીચમ ડેક્સટાઈલ માર્કેટની પાછળ, અભિષેક માર્કેટ પાસે, રીંગ રોડ, તા. સુરત સિટી ડિસ્ટ્રીક્ટ સુરત ગુજરાત – ૩૯૫૦૦૨.	૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ પ્રત્યક્ષ કબજો

ઉધારકર્તા રકમ ચકવવામાં નિષ્કળ ગયા હોવાથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સદરહ કાયદા ની કલમ ૧૩ (૪) અંતર્ગત નિયમ ૯ સાથે વંચાણે લેતાં મળેલ સત્તાની રૂએ અદ્યોહસ્તાક્ષરીએ ઉપર "કબજા તારીખ" કોલમમાં દર્શાવેલ કબજાની તારીષ માણે મિલકતોનો **કબજો** લીધેલ છે.

ઉદ્યારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકતો અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે સદરહુ સ્થાવર મિલકતો અંગે કરેલો કોઈપણ વ્યવહાર **કોટક મહીન્દ્રા બેંક લી.** ની માંગણ નોટીસમાં દર્શાવેલ રકમ અને તેની ઉપરના કરાર દ ાધારાના વ્યાજ અને સબ્સ્ટીટયુટ વ્યાજ ઉપર દર્શાવેલ વિગતોમાં બાકી રકમ દર્શાવેલ તારીખ થી તુરંતની બીજી તારીખથી ચુકવણી તારીખ સુર્ધ અને અનુસાંગિક ખર્ચા, કોસ્ટ, ચાર્જીસ સાથે બોજાને આધીન ૨હેશે. સદરહુ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાની મુકર

મેલકત છોડાવવા માટે મળવા પાત્ર સમચ બાબતે ધ્યાન દોરવામાં આવે છે. મહેરબાની કરીને નોંધ લેશો કે મિલક્તોનું વર્ણન ઉપર દર્શાવેલ છે.

નારીખઃ ૧૧.૦૨.૨૦૨૩ અને ૧૩.૦૨.૨૦૨<sup>૩</sup> અધિકૃત અધિકારી, કોટક મહીન્દ્રા બેંક લી.



# **MAZDA LIMITED**

CIN : L29120GJ1990PLC014293 Regd. Office : C/1-39/13/16 GIDC Naroda, Ahmedabad - 382 330 EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31<sup>ST</sup> DECEMBER 2022

				(₹in La	cs except EPS)	
Sr.			Year ended			
No.	Particulars	31/12/2022	30/09/2022	31/12/2021	31/03/2022	
NO.			Unaudited			
1	Total Income from operations	4331.04	5177.43	4307.74	16499.36	
2	Net Profit / (loss) from ordinary activities before tax, exceptional or extra-ordinary items	861.30	536.37	651.69	2764.95	
3	Net Profit / (loss) from ordinary activities after tax	660.90	389.54	482.39	2124.39	
4	Net Profit / (loss) for the period after tax (after extraordinary items)	660.90	389.54	482.39	2124.39	
5	Total Comprehensive Income for the period [comprising profit / (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	645.83	398.26	488.52	2100.53	
6	Paid-up equity share capital (Face Value of Rs. 10 per share)	400.50	400.50	400.50	400.50	
7	Other Equity excluding Revaluation Reserve				16002.30	
8	Basic and Diluted Earnings per share of Rs. 10/- each	16.50	9.73	12.04	53.04	
⊢-						

(i) The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results for the quarter ended 31/12/2022 are available on the Stock Exchanges website i.e. www.bseindia.com and nseindia.com as well as on the Company's Website i.e. www.mazdalimited.com.

(ii) The aforesaid financial results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 13/02/2023 and approved by the Board of Directors at its meeting held on the same date.

FOR & ON BEHALF OF THE BOARD OF MAZDA LIMITED

PERCY AVAR WHOLE-TIME DIRECTOR DIN:00499114



PLACE : AHMEDABAD

DATE : 14/02/2023

### **KEMISTAR CORPORATION LIMITED**

604, Manas Complex, Near Jodhpur Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat. CIN: L24233GJ1994PLC022845 Email: kemistarbse@gmail.com Web: www.kemistar.in

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022

(Rs. In Lakhs Except EPS)

Sr.	Particulars Particulars		Year Ended		
No.			30.09.2022	31.12.2021	31.03.2022
1	Total Income from Operations	562.78	372.88	235.10	2097.08
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items#)	26.81	17.76	13.40	108.09
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional items#)	26.81	17.76	13.40	108.09
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items#)	21.19	12.80	11.01	83.92
5	Total Comprehensive Income for the period				
	[Comprising Profit / (Loss) for the period (after tax) and Other				
	Comprehensive Income (after tax)]	21.19	12.80	11.01	83.92
6	Equity Share Capital	1075.94	1075.94	1075.94	1075.94
7	Earnings Per Share of Rs.10/- each)				
	1. Basic: (In Rs)	0.20	0.12	0.10	0.78
	2. Diluted: (In Rs)	0.20	0.12	0.10	0.78
	NOTE: KEY STANDALONE FINANCIALS OF T	HE COMPA	ANY IS AS	UNDER	

Total Income from Operations 90.06 55.67 79.99 644.54 Net Profit/(Loss) for the period before tax (after Exceptional items#) 8 98 8 08 7 64 29 38 Net Profit / (Loss) for the period after tax (after Exceptional items# 6.52 5.61 5.69 22.95

a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated financia result for the quarter ended on 31.12.22 is available on the websites of www.bseindia.com and at www.kemistar.ir

b) The above financials were reviewed by the audit committee and approved by the Board of Directors in the meeting held or February 14, 2023 c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules

whichever is applicable

For Kemistar Corporation Limite

Date: February 14, 2023 Place: Ahmedahad

Ketan Patel **Managing Director** (DIN No. 01157786)

इंडियन बैंक Indian Bank 🛕 इलाहाबाद

માધાપર બ્રાન્ય, પ્લોટ નં. ૩/૨/७૩-એ, માધવ આર્કેડ, વથાણ ચોક પાસે, નવાવાસ, માધાપર-૩७૦૦૨૦. તા. ભુજ, જિલ્લો - કચ્છ. ફોન : ૦૨૮૩૨-૨૪૦૨૫७

માંગણા નોટિસ

ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ

yld.

૧. શ્રી કિરીટભાઈ અમૃતભાઈ વાળંદ (દેવાદાર અને ગીરવેદાર) પ્લોટ નં. ૭૨ ના સંબ પ્લોટ નં. ૭૨/સી, આર.એસ.નં. ૫૫૦, પંકલ નગર, કોટક નગર પાસે, નવાવાસ, માદ્યાપર, તા. ભુલ,

જી.કચ્છ-૩૭૦૦૨૦.ક્ષેત્રફળ ૪૩.૫૨ ચો.મી.(બાંધકામ વિસ્તા૨).

ખાતે પણ: પટેલવાસ, થારાવાડા નાના, વરલી, તા. ભુજ, જી. કચ્છ-3૭૦૧૩૦.

ર. શ્રીમતી અરૂણાબેન કિરીટભાઈ વાળંદ (સહ-દેવાદાર) પટેલવાસ, થારાવાડા નાના, વરલી, તા. ભુજ, જી. કચ્છ-390930.

વિષય : તમારું ઈન્ડિયન બેંક (અગાઉ અલાહાબાદ બેંક), માધાપર શાખા સાથે રજી. હોમ લોન ખાતા (૫૦૪७૧૮૦૫૧૦૦)

તમારામાંના પ્રથમ વ્યક્તિગત દેવાદાર અને ગીરવેદાર છો જેણે તમારા દ્વારા મેળવવામાં આવેલા લોન ખાતામાં સિક્યોરીટી તરીકે તમારી મિલકતો મુકી છે. તમારામાંના દ્ધિતિય તમારામાંના પ્રથમ દ્વારા મેળવેલ લોનમાં સહ-દેવાદાર છો. તમે બંનેની વિનંતી પર, બેંકિંગ વ્યવહારો અનુસાર નીચેની સવલતો મંજુર કરાઇ હતી , જે તમે બંને દ્વારા લેવામાં આવી હતી . મર્ચાદા (રૂપિયા લાખમાં) सवलतनो प्रकार

341 01.	בויינוטוו אסונ	गवाटा (श्रापवा दालिगा)
1.	હોમલોન	૮.૧૫ લાખ

કથિત લોનની પુનઃચૂકવણી અહીં નીચે પત્રકમાં આપ્યા પ્રમાણે પ્લોટ નં. ૭૨ ના સબ પ્લોટ નં. ૭૨/સી , આ૨.એસ.નં. ૫૫૦ , પંકજ નગ૨ , કોટક નગર પાસે, નવાવાસ, માદ્યાપર, તા. ભુજ, જી. કચ્છ-3900૨૦ ખાતે સ્થિત તમારામાંના પ્રથમથી સંબંધિત મિલકતના ગીરો દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. તમારામાંના દરેક અને પ્રત્યેકે વ્યાજ સહીતની રકમ ચુકવવા માટે વારંવારની દરખાસ્તોને અવગણી છે અને સંયુક્ત અને વ્યક્તિગત રીતે

જવાબદારીમાં નિષ્ફળ ગયા છો અને બાકી રકમની ચુકવણીમાં કસૂરવાર ઠર્યા છો. લોન એકાઉન્ટ રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ એસટ્સ વર્ગીકરણને સબંધિત નિર્દેશો/માર્ગદર્શનો અનુસાર **૨૯/૦૧/૨૦૨૩** થી **નોન પરફોર્મિંગ એસેટ** તરીકે વર્ગીકૃત કરાયા છે.

ક્રમ	3	મર્ચાદા	30.09.2023	ઉપાર્જીત પરંતુ	૩૦.૦૧.૨૦૨૩ મુજબ
नं.	લોન ખાતા નંબર		મુજબ બાકી રકમ	નહીં ઉદ્યારેલ વ્યાજ	કુલ બાકી રકમ
٩.	હોમ લોન ૫૦૪७૧૮૦૫૧૦૦	८,१५,०००.००	6,06,665.00	૨૫,७०८.००	e,34,७०४.० <b>०</b>
	ટોટલ	८,९५,०००.००	e,oe,ees.oo	૨૫,७०८.૦૦ વત્તા બાકી લેણાંની આખરી પતાવટ સુધી ઉપાર્જીત થનારુ વ્યાજ	૯,૩૫,७०૪.૦૦ વત્તા બાકી લેણાંની આખરી પતાવટ સુધી ઉપાર્જીત થનારુ વ્યાજ

તમારા તરફથી ચુકવાપાત્ર બાકી લેણાંની 30/0૧/૨૦૨૩ ના મુજબ રકમ રૂા. ૯,૩૫,७०४.૦૦/- (રૂા. નવ લાખ પાંત્રીસ હજાર સાતસો ચાર પુરા) છે અને જણાવેલ ૨૬મ પુર્નચુકવણીની તારીખ સુધી ૩૧/૦૧/૨૦૨૩ થી સંમત થયેલા દરે આગળનું વ્યાજ ધરાવે છે.

સિક્યોરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ ટર્મ દેવાદાર શબ્દ એટલે કે કોઇ વ્યક્તિ જેણે બેંક પાસેથી નાણાંકિય સહાય મેળવી છે અથવા જેણે કોઇ ગેરંટી આપી છે અથવા કોઇ ગીરો રચ્યો છે/બેંક દ્વારા મંજુર કરાયેલ નાણાંકિય સહાય માટે સિક્યોરીટી તરીકે ગીરો મુકી છે.

આથી , તમો તમામ અને તમારામાંના દરેકને 30/0૧/૨૦૨૩ મુજબની રૂા. ૯,૩૫,७૦૪.૦૦/- (રૂા. **નવ લાખ પાંત્રીસ હજાર સાતસો ચાર** પુરા) તરીકેની રકમ જેવા લેણાંની રકમ આ તારીખથી ચૂકવણીની તારીખ સુધીના વ્યાજ સહીત કલમ ૧૩(૨) હેઠળ જારી કરાયેલ આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવી જવા માટે જણાવવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં બેંકને કથિત એક્ટ હેઠળ તમને કોઇ અન્ય નોટીસ આપ્યા વગર એનકોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઇન્ટરેસ્ટના તેમના હકનો ઉપયોગ કરવાની કરજ પડશે. જો તમે આ નોટિસની તારીખથી ૬૦ દિવસની અંદર તમારા સંપૂર્ણ બાકી લેણાંમાંથી છુટકારો મેળવવામાં નિષ્ફળ જશો તો અહીં નીચે પરિશિષ્ટમાં આપેલ સિક્ચોર્ડ એસેટોની સામે કાયદાની કલમ ૧૩(૪) હેઠળ બેંક તેના એનફોર્સમેન્ટ હકોનો ઉપયોગ કરશે.

આ નોટીસની તારીખથી ૬૦ દિવસની પુરા થયે અને માંગણાનું પાલન કરવામાં તમારી નિષ્ફળતા પર, બેંક કાયદા હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરીને કબજો લેવા આવશ્યક પગલા લેશે.

મહેરબાની કરીને નોંધ લેવી કે કાયદાની ક્લમ ૧૩(૧૩) ની જોગવાઇઓ અનુસાર બેંકની આગોતરી લેખિત મંજુરી વગર આ નોટીસની તારીખ પછી વેચાણ, ભાડે કે અન્ય રીતે સિક્ચોર્ડ એસેટ ( અહીં નીચે પત્રકમાં આપેલ )ની ફેરબદલી કરી શકાશે નહીં.

એ જણાવાની જરૂર નથી કે આ નોટીસ ડીઆરટી / ડીઆરએટી / કોર્ટના ડીઆરએ / આરએ સમક્ષ કાર્યવાહીને આગળ વધારવાના અને આદેશ / ચુકાદાનો અમલ કરવા / મેળવવાની પ્રક્રિયા માટે બેંકને ઉપલબ્ધ કોઇપણ અન્ય ઉપાયો પ્રત્યે પુર્વગ્રહ વગર તમને સંબોધિત છે. કૂપા કરીને નોંધ લેવી કે બેંકના વટાવગત બાંકી લેણાં , બેંક ગેરેટી અને ક્રેડીટરના પત્ર અને તમારા વર્તી સ્વીકૃતિ હેઠળ ઉપજેલ લેણાં અને . અન્ય આકિસ્મક લેણાં ચુકવવા માટે તમને જણાવવાનો તેનો હક અનામત રાખે છે.

"સરફેસી કાચદાની કલમ ૧૩ (૮) અને તેના હેઠળ બનાવેલા નિચમોની સિક્ચોરીટીઓ પરત મેળવવાના તમારા અધિકારના ઉપયોગની જોગવાઈઓ પ્રત્યે અમે તમારૂ ધ્યાન દોરીએ છીએ."

नीये सही કરનાર કથિત એક્ટની કલમ ૧૩ની જોગવાઇઓ हेઠળ સત્તાનો ઉપયોગ કરનાર અને નોટીસ જારી કરનાર અધિકૃત અધિકારી છે.

# અનુસૂચિ

મિલકતની વિશિષ્ટ વિગતો કે જેમાં સિકચોરીટી ઈન્ટરેસ્ટ બનાવવામાં આવ્યું છે તે નીચે મુજબ છે. ગીરો મિલકતો : શ્રી કિરીટભાઈ **અમૃતભાઇ વાળંદ**ના નામે જીલ્લા અને રજીસ્ટ્રેશન ઉપ જીલ્લા ભુજમાં ગામ માધાપર, તા. ભુજ, જી. કચ્છના સર્વે નં. ૫૫૦, પ્લોટ નં. ૭૨ કોટક નગર પાસે. નવાવાસ ખાતે પંકુજ નગરમાં ૪૭.૫૦ ચો.મી.માપના સબ પ્લોટ નં. ૭૨/સી ખાતે આવેલ જમીનના તે તમામ પીસ અને પાર્સલ. **મિલકતની ચતુઃસીમાઃ પૂર્વઃ** સમાન આર.એસ.નં. ના સબ પ્લોટ નં. ૭૨/બી, **પશ્ચિમઃ** સમાન આર.એસ.નં. ના પ્લોટ નં. ૬૧ ઉત્તર: સમાન આર.એસ.નં. નો કોમન પ્લોટ, દક્ષિણ: સમાન આર.એસ.નં.ના પ્લોટ નં. ૭૧.

તારીખ : ૩૦.૦૧.૨૦૨૩ સ્થળ : રાજકોટ

અધિકૃત અધિકારી ઈન્ડીયન બેં<del>ક</del>

[Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income

Reserves (excluding Revaluation Reserve as

shown in the Balance sheet of previous year)

Earning Per Share (of Rs. 10/- each) (for continuing and discountinued operations)

Face Value of Equity Shares

Equity Share Capital

Basic :

Basic:

Diluted

Reserves (excluding Revaluation Reserve as

shown in the Balance Sheet of previous year)

(for continuing and discontinued operations)

Earnings Per Share (of Rs. 10/- each)

Nine Months Ended

Year Ended



(after tax)] Equity Share Capital

Basic:

OSIA HYPER RETAIL LIMITED

CIN: L52190GJ2013PLC077269 Registered Office: Basement Store 1, 4D Square, Opp. IIT Eng College Nr D-Mart, Visat Gandhinagar Highway, Motera, Ahmedabad 380005 Gujarat, India. Telephone: +91 72270 57148; Website: www.osiahypermart.com; Email: contact@osiamart.com

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2022 (Rs. In Lacs except for earning per share data) Nine Months 3 Months Ended Ended Ended Particulars 3 8 1 31.12.2022 31.03.202 31,12,2022 30,09,2022 Unaudited Unaudited Unaudited Audited Total Income from Operations 20,835.51 16.360.3 55.088.82 59,172.10 1,137.10 Net Profit! (Loss) for the period (before Tax, 399.40 363.67 1,254.7 Exceptional and/ or Extraordinary items) 1,232.0 Net Profit! (Loss) for the period before Tax 399.40 363.67 1,137.10 (after Exceptional and/ or Extraordinary items) 904.0 Net Profit/(Loss) for the period after Tax 272.14 850,89 298.87 (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period 298.87 272.14 850.89 904.0

1031.23

10 Rs.

1031.23

10 Rs.

1031.23

10 Rs.

9.32

For, OSIA HYPER RETAIL LIMITED

595.3

8,539.54

10 Rs

15.18

9.32 Diluted 15.1 Note: The above is an extract of financial results of the company and the detailed Unaudited Financial Results of the Company for the Quarter ended on 31st December, 2022 filed with the Stock Exchange Under Regulation 33 o the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Financial Results are available on the Stock Exchange Website www.nseindia.com and on Company's website

Place: Ahmedabad Archna Nagrani Date: 15.02.2023 Director (DIN: 02545015)

# RAJKOT INVESTMENT TRUST LIMITED (CIN:L65910GJ1982PLC005301)

Regd. Office: 526 Star Chambers Harihar Chowk, Rajkot, Gujarat 360001 Email id: rajkotitltd@gmail.com | Website : www.ritl.co.in

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2022

	(Rs. in lac							
		Quarter	Ended	9 Months Ended	Year Ended			
SI No.	Particulars	31/12/2022 (Un-Audited)	31/12/2021 (Un-Audited)		31/03/2022 (Audited)			
1,	Total income from operations (net)	3.93	11.53	17.14	53.88			
	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax	0.76	9.15	5.22	9.03			
	(after Exceptional &/or Extraordinary items)	0.76	9.15	5.22	4.74			
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional &/or Extraordinary items)	0.76	9.15	5.22	(1.89)			
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.76	9.15	5.22	(1.89)			

100.00

0.08

100.00

0.00

0.92

100.00

0.00

0.52

100.00

350.38

(0.19

0.08 0.92 0.52 Diluted: (0.19)Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results for the quarter and Nine Months ended on 31st December, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company i.e. www.ritl.co.in and on the website of BSE Ltd (www.bseindia.com)

For, RAJKOT INVESTMENT TRUST LIMITED

Mosamben Keyur Mehta Date: 14.02.2023 (Director Place: Surat DIN: 09757064

## THE BARODA RAYON CORPORATION LIMITED Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555 Email-brcsurat@gmail.com, admin@brcl.in, CIN - L45100GJ1958PLC000892, website-www.brcl.in

Extract of Standalone Un-audited Financial Results for the Quarter&nine

months ended 31st December, 2022

(F in lakhs except EPS Quarter ended Nine months ended Quarter ended Sr. 31.12.2022 31.12.2022 31.12.2021 Particulars (Un-audited) (Un-audited) (Un-audited) Total income from operations (net) 753.25 2133.25 16 2 Net Profit / (Loss) for the period 210.18 (before Tax, Exceptional and/or 23920.46 24977.66 Extraordinary items) 3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or 23920.46 24977.66 210.18 Extraordinary items#) 4 Net Profit / (Loss) for the period after tax 23920.46 24977.66 210.18 (after Exceptional and/or Extraordinary items Total comprehensive Income for the period [comprising Profit/(Loss) for the 23920.46 24977.66 44991.35 period (after tax) and other Comprehensive Income (after tax)] 6 Equity Share Capital 2291.14 2291.14 2291.14 7 Reserves (excluding Revaluation) Reserve) as shown in the Balance Sheet of the previous year 8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) and company's website (www.brcl.in).

104.40

104.40

109.02

109.02

For The Baroda Rayon Corporation Limited

0.92

0.92

Damodarbhai Patel

Date: 14-02-2023 Managing Director Place : Surat. DIN-00056513

# Shri Jagdamba Polymers Limited

CIN: L17239GJ1985PLC007829 Registered Office: HARMONY, 4th Floor, 15/A, Shree Vidhyanagar Co.op. Hsg. Soc. Ltd. Opp. Nabard, Nr. Usmanpura Garden, Ahmedabad – 380014 • Tel.: 079-26565792, **E-mail Id:** admin@iagdambapolymers.com • **Website:** www.shrijagdamba.com

	cost of Unaudited Financial Decute for th		, 0	
I=XU	act of Unaudited Financial Results for th	e Quarter/ Nii		is except EPS
Sr. No.	Particulars	Quarter Ending on 31.12.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 31.12.2021
1	Total income from operations (net)	6632.03	38092.85	10273.22
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	501.83	6737.24	1704.45
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	501.83	6737.24	1704.45
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	406.35	5116.04	1227.09
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	406.35	5118.91	1227.09
6	Equity Share Capital	87.58	87.58	87.58
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	-	18274.38	-
8	Face Value of Equity Share Capital (Rs.)	1/-	1/-	1/-
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	4.64	58.45	14.01

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and company website www.shrijagdamba.com

For. Shri Jaqdamba Polymers Ltd

Ramakant Bhojnagarwala **Managing Director** DIN: 00012733

SHREEJI NAGAR, SAVARKUNDLA,

GUJARAT-364515

**BAJAJ HOUSING FINANCE LIMITED** 

Corporate office: Cerebrum IT Park B2 Building 5th floor, Kalvani Nagar, Pune, Maharashtra 411014. Rajkot Branch: 3rd floor, Gondal Rd, Udhyog Nagar Colony, Bhakti Nagar, Rajkot, Gujarat 360002 Amreli Branch: 1st Floor, Parikh Chamber, Beside Kotak Mahindra Bank, Raj Kamal Chowk, Amreli-365601

POSSESSION NOTICE U/s 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Rule 8-(1) of the Security Interest (Enforcement) Rules 2002. - (Appendix-IV)

Whereas, the undersigned being the Authorized Officer of M/s BAJAJ HOUSING FINANCE LIMITED (BHFL) under the Securitization and Reconstruction o Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notice(s) to Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) and the public in general that the undersigned on behalf of M/s BAJAJ HOUSING FINANCE LIMITED, has taken over the possession of the property described herein below in exercise of the powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8-(1) of the said rules. The Borrower(s) /Co Borrower(s)/ Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with the below said property and any dealings with the said property will be subject to the first charge of BHFL for the amount(s) as mentioned herein under with future interest thereon.

SI. No.	, ,	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date and Amount	Date of Possession
1	Branch: RAJKOT, Lan No. 416TSH61971851 and 416HSL60493616 Borrower's: / Co – borrower's 1. JAYESH C JOSHI, (Borrower) At FLAT NO B602 VARDHMAN HEIGHTS, JAMNAGAR ROAD, OPP GHANTESWAR SRP CAMP, NR BAPASITARAM CHOWK NEAR BAPASITARAM CHOWK, RAJKOT-360006	All that piece and parcel of the Non-agricultural Property described as: RS NO. 140P PLOT NO. A/27 A/38P VARDHMAN HEIGHTS, FLAT NO B-602 VARDHMAN NAGAR OPP, GHANTESHVAR NEW 150 FT RING ROAD GHANTESHWAR, RAJKOT, GUJARAT-360006, East: Margin & Road, West: Open space passage, North: Open Space, Lift and stairs, South: Margin Area	20th May 2022 Rs. 18,22,901/- (Rupees Eighteen Lac Twenty Two Thousand Nine Hundred One Only)	09.02.2023
2	Branch: AMRELI, Lan No. H4A9FRL0353787 Borrower's: / Co – borrower's  1. PRAVINBHAI NAJABHAI SINDHAV, Borrower  2. HEMABEN N SINDHAV, Co- Borrower Both are residing at: UTAVLA HANUMAN MANDIR CHOWK HATHSANI ROAD, NEAR	All that piece and parcel of the Non-agricultural Property described as: CITY SURVEY NO. 3527 Paiki, Shreeji Nagar, Nr. Utavala Hanuman Temple, Hathsani Road, At Savarkundla, Tal Savarkundla, Dist: Amreli -364515 SAVARKUNDLA GUJARAT-364515 East: CS No. 3522 Paiki, West: CS No. 3528 Paiki, North: CS No. 3526 Paiki, South: ROAD		10.02.2023

Date: 15.02.2023 Sd/- Authorized Officer Place: Gujarat **BAJAJ HOUSING FINANCE LIMITED** 

FEDBANK FINANCIAL SERVICES LTD. FEDBANK Having corporate office at Kanakia Wall Street, A-Wing, 5th Floor, Unit No.501, 502, 511, 512 Andheri - Kurla Road, Chakala, Andheri East, Mumbai, Maharshtra - 400093

Whereas The undersigned being the Authorized Officer of Fedbank Financial Services Ltd. under the Securitisation and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated November 23, 2022 calling upon the Borrower, Mortgagor, Co-Borrower(s) and Guarantor:- (1) Shree I G Krushi (Borrower); (2) Vithalbhai Laljibhai Luhar (Co-Borrower) (3) Pradipbhai Vithalbhai Luhar (Co-Borrower); (4) Tejalben Pradipbhai Luhar; (5) Niruben Vithalbhai Luhar to repay the amount mentioned in the said notice being Rs. 41,07,288/- (Rupees Forty One Lakh Seven Thousand Two Hundred Eighty Eight Only) in Loan Account No. FEDMEHSTL0479984 & Rs. 6,07,225/- (Rupees Six Lakh Seven Thousand Two Hundred Twenty Five Only) in Loan Account No. FEDMEHSTL0484710 both as on November 17, 2022 together with further interest thereon at the contractual rate plus all costs charges and incidental expenses etc. within 60 days from the date of receipt of the said demand notice.

**POSSESSION NOTICE** 

The Borrower, Mortgagor, Co-Borrower(s) and Guarantor mentioned hereinabove having failed to repay the above said amount within the specific period, notice is hereby given to the Borrower, Mortgagor, Co-Borrower(s), Guarantor and the public in general that the undersigned Authorised officer has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the SARFAESI Act read with Rule 8 of Security Interest (Enforcement) Rules, 2002 on this the February 14 of the vear 2023

The Borrower, Mortgagor, Co-Borrower(s) and Guarantor mentioned hereinabove in particular and the public in general is/are hereby cautioned not to deal with the following property and any dealings with the following property will be subject to the charge of Fedbank Financial Services Ltd. for an amount Rs. 41,07,288/- (Rupees Forty One Lakh Seven Thousand Two Hundred Eighty Eight Only) in Loan Account No. FEDMEHSTL0479984 & Rs. 6,07,225/- (Rupees Six Lakh Seven Thousand Two Hundred Twenty Five Only) in Loan Account No. FEDMEHSTL0484710 both as on November 17, 2022 together with further interest thereon at the contractual rate plus all the costs charges and incidental expenses etc

The borrower's attention is invited to sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

### **SCHEDULE I DESCRIPTION OF THE MORTGAGED PROPERTY**

Property No. 1 - All that right, title and interest of Property bearing at Unjha R. S. No. 988, T P Scheme No. 5, Fa. Plot No. 225, Block - F, Plot No. 1 & 2 admeasuring each Plot 22.26.50 sq. mtr. Total 44.53 sq. mtr. Ts. Unjha Dist. Mehsana

The said property is bounded as under: North: 6.09 mtr. Wide Road South: Plot No. 17 & 18

East: Plot No. 03 West: 6.09 mtr. Wide Road Property No. 2 - All that right, title and interest of Property bearing at Unjha R. S. No. 988, T P Scheme No. 5, Fa. Plot No. 225, Block – F, Plot No. 17 admeasuring each Plot 22.26.50 sq. mtr. Total 44.53 sq. mtr. Ts. Unjha Dist. Mehsana

The said property is bounded as under: North: Plot No. 02 South: 6.09 mtr. Wide Road East: Plot No. 16 West: Plot No. 18

Place:- Mehsana, Gujarat Date- 15-02-2023

Fedbank Financial Services Ltd (AuthorizedOfficer



# **MAZDA LIMITED**

Regd. Office: C/1-39/13/16 GIDC Naroda, Ahmedabad - 382 330 EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE

QUARTER ENDED 31<sup>57</sup> DECEMBER 2022 (₹ in Lacs except EPS) Quarter Ended Year ended **Particulars** 31/12/2022 30/09/2022 31/12/2021 31/03/2022 No. Unaudited Audited Total Income from operations 4331.04 5177.43 4307.74 16499.36 2 Net Profit / (loss) from ordinary activities before tax, 861.30 536.37 651.69 2764.95 exceptional or extra-ordinary items 3 Net Profit / (loss) from ordinary activities after tax 660.90 389.54 482.39 2124.39 4 Net Profit / (loss) for the period after tax 660.90 389.54 482.39 2124.39 (after extraordinary items) 5 Total Comprehensive Income for the period 645.83 398.26 488.52 2100.53 [comprising profit / (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] 400.50 400.50 400.50 400.50

6 Paid-up equity share capital (Face Value of Rs. 10 per share) 7 Other Equity excluding Revaluation Reserve 16002.30 8 Basic and Diluted Earnings per share of Rs. 10/- each 16.50 9.73 12.04 53.04 NOTE: The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under

Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results for the quarter ended 31/12/2022 are available on the Stock Exchanges website i.e. www.bseindia.com and nseindia.com as well as on the Company's Website i.e. www.mazdalimited.com.

(ii) The aforesaid financial results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 13/02/2023 and approved by the Board of Directors at its meeting held on the same date.

FOR & ON BEHALF OF THE BOARD OF MAZDA LIMITED

PERCY AVARI PLACE: AHMEDABAD WHOLE-TIME DIRECTOR DATE : 14/02/2023 DIN:00499114

Public Notice For E-Auction Cum Sale (Appendix - IV A) (Rule 8(6)) Sale of Immovable property mortgaged to IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing I at Plot No.98, Udyog Vihar, Phase-IV, Gurgaon-122015. (Haryana) and Branch Office at-Office No.701, 7th Floor, 21st Centuary Business Center, Nea Udhna Darwaja, Ring Road, Surat - 395002/ Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr Shell Petrol Pump, Anandnaga Road, Prahladnagar, Ahmedabad - 380051 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002(hereinafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possession of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS

for realization of IIFL-HFL's dues, The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com Borrower(s) / Co-**Demand Notice** Description of the Immovable Date of Physical property/ Secured Asset Borrower(s) / Guarantor(s) Date and Amount Possession 18-May-22 & Rs.8,89,348/- All that part and parcel of the prop-11-Dec-2022 Rs. 7,50,000/-(Rupees Eight Lakh Eighty erty bearing Plot No-353, Total Outstanding As Nine Thousand Three Admeasuring 40.18 Sq.Mtr. and On Date 109-Eeb-2023 (Rupees Seven Lakh Fifty 1.Mr. Dharmesh bhai Nine Thousand Three On Date 09-Feb-2023 Shantu Patel Undivided Share of 23.50 Sq.Mtr. . Hundred Forty Eight Only) **Rs. 14,30,983/-** (Rupees **Earnest Money Deposit** Arya Residency, Kareligam, 2.Mrs.Bhartiben Patel Bid Increase Amount Fourteen Lakh Thirty Palsana, Surat, 394601, Gujarat, (EMD) Rs. 75,000/-(Prospect No. 880399) Thousand Nine Hundred Rs. 20,000/- (Rupees (Rupees Seventy Five India. Eighty Three Only) Twenty Thousand Only) Thousand Only) 26-Oct-2021 & Rs.23,16,227/- All that part and parcel of the proper-13-Nov-2022 Rs. 14,00,000/-1.Mr. Pratapram (Rupees Twenty Three Lakh Sixteen Thousand Two ty bearing Flat No. A 103, Total Outstanding As Admeasuring 51.03 Sq.Mtrs, Ganesh On Date 08-Feb-2023 (Rupees Fourteen Lakh Girdharilalji Dewasi Only) 2.Mrs.Dhalaki Devi Apparment, Survey No. 455, 456 And Rs. 27,42,295/- (Rupees Hundred Twenty Seven Only) Earnest Money Deposit Final Plot No. 13/2, 13/2/1, T.P. 80, Twenty Seven Lakh Forty Bid Increase Amount Nr Aims International School , Narol-(EMD) Rs. 1,40,000/-Two Thousand Two Rs. 25,000/- (Rupees Twenty Vatva Canal Road , Narol (Prospect No. 829468) **Hundred Ninety Five** (Rupees One Lakh Forty Five Thousand Only) Ahmedabad, 382405, Gujarat, India. Date of Inspection of property: EMD Last Date Date/ Time of E Auction

01-Mar-2023 1100 hrs -1400 hrs 03-Mar-2023 till 5 pm. 06-Mar -2023 1100 hrs-1300 hrs. Mode of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or through RTGS/NEF The accounts details are as follows: a) Name of the Account:- IIFL Home Finance Ltd., b) Name of the Bank:- Standard Chartered Bank, c) Accoun No:-9902879 followed by Loan Number, d) IFSC Code:-SCBL0036001 e) Bank Address: Standard Chartered Bank, 90 M.G. Road, Fort, Mumbai-40000 **TERMS AND CONDITIONS:-**

For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com , we in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM" along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office.

The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the last minutes of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes. The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of

the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property. Bidders are advised to go through the website https://bankeauctions.com and https://www.iifl.com/homé-loans/properties-for-auction for detaile terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings.

For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E mail ID:- support@bankeau tions.com, Support Helpline Numbers:@7291981124/25/26.and for any query related to Property details, Inspection of Property and Online bid etc. call IIFL HFL toll free no. 1800 2672 499 from 09:30 hrs to 18:00 hrs between Monday to Friday or write to email:- auction.hl@iifl.com. Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of taking physical possessionwithin 7 days, otherwise IIFL-HFL shall not be responsible for any loss of property under the circumstances. Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law.

In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled and the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale. 10. AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case of any

dispute in tender/Auction, the decision of AO of IIFL-HFL will be final. 15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002 The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost.

ைerco Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2022

Corporate Indentity Number: L35999GJ1982PLC005203 Regd. Office: Baroda - Godhra Highway, Kalol, District Panchmahal, Pin Code - 389 330, Gujarat | Tel: 02676 - 270600, Fax: 02676 - 235524

Website: www.setcoauto.com | Email: investor.relations@setcoauto.com

Sr.	Particulars	Quarte	r Ended	Nine Months Ended		Year Ended	
			31-Dec-21 (Unaudited)	31-Dec-22 (Unaudited)	31-Dec-21 (Unaudited)	31-Mar-22 (Audited)	
1	Total income from operations	11,036	12,068	38,804	33,688	44,490	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4,672)	(3,932)	(11,878)	(6,846)	(15,172)	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(4,842)	(3,932)	(12,049)	(21,325)	(25,412)	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4,842)	(3,957)	(12,039)	(23,081)	(25,748)	
5	Total Comprehensive Income for the period [Comprising Profit' (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(4,347)	(3,910)	(11,679)	(23,082)	(25,931)	
6	Paid-up Equity Share Capital (F.V. of ₹ 2/- each)	2,675	2,675	2,675	2,675	2,675	
7	Other Equity					(26,716)	
8	Earnings Per Share (F.V. of ₹ 2/- each)					(50000000000	
	Basic	(2.51)	(2.63)	(7.09)	(15.02)	(16.77)	
	Diluted	(2.51)	(2.63)	(7.09)	(15.02)	(16.77)	

31-Dec-22 31-Dec-21 31-Dec-22 31-Dec-21 31-Mar-22 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) 1,125 121 16,194 Total income from operations (135)16,160 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or (203)98 (57)(7,944)(17,072)Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (203)64 (57)(17,328)(9,708)

Quarter Ended

Sr. Particulars

 The Financial Results for the quarter and nine months ended December 31, 2022 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on February 14, 2023. The above is an extract of the detailed format of financial results for the quarter and nine months ended December 31, 2022 filed with the Stock Exchange under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requiremens) Regulations, 2015. The detailed format of the financia results for the quarter and nine months ended December 31, 2022 are available on the company's website (www.setcoauto.com) and Stock

Exchange website (www.bseindia.com & www.nseindia.com) Previous period figures have been regrouped/rearranged wherever considered necessary.

For and on behalf of the Board Sd/ Harish Sheth Place: Mumbai Chairman & Managing Director Date: February 14, 2023 DIN: 01434459

Public Notice For E-Auction Cum Sale (Appendix - IV A) (Rule 8(6)) at Plot No.98,Udyog Vihar, Phase-IV,Gurgaon-122015.(Haryana) and Branch Office at- Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr Shell Petrol Pump, Anandnagar Road, Prahladnagar, Ahmedabad - 380051/ Office No.701, 7th Floor, 21st Centuary Business Center, Nea Udhna Darwaja, Ring Road, Surat - 395002/ 303, 3rd Floor, Bhagwandas Chambers, Opp, Circuit House, R C Dutt Road, Vadodara, Pin Code 390007 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002(hereinafter "Act"). Whereas the Auhorized Officer ("AO") of IIFL-HFL had taken the possession of the following property/ies pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IIFL-HFL's due: The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeauctions.com

Borrower(s)/ Demand Notice Date Co-Borrower(s)/ and Amount		Description of the Immovable property/ Secured Asset		Possession		Reserve Price	
Guarantor(s)  1.Mr. Prakash  Hariprasad Pandey  2.Mr.Hari Prasad	05-Oct-2021 Rs. 14,70,186/- (Rupees Fourteen Lakh Seventy Thousand One Hundred	All that part and parcel of the property bearing F-204, Second floor, Narayan Crystal, situated at T.P no. 86 SR no. 1071/3 FP no. 33/3/1, super built up area measuring 75 sq yds Opp Ashopalav Society. Jain Ashram Road.		Total Outstanding		<b>Rs. 10,25,000/-</b> (Rupees Ten Lakh Twenty Five Thousand Only)	
3.Mrs.Sheemadevi H Pandey	Eighty Six Only)  Bid Increase Amount			Rs. 18,74,205/-		Earnest Money Deposit (EMD Rs. 1,02,500/-	
(Prospect No. 890201)	Rs. 25,000/- (Rupees Twenty Five Thousand Only)	1			ir Thousand	(Rupees Óne Lakh Two Thousand Five Hundred Only)	
1. Mr. Raju Satya	10-Jun-2022	All that par	t and parcel of the	11-Dec	-2022	Reserve Price	
3.Mrs.Urvashi Satya Lovesetty (Prospect No. Rs.	Rs. 13,09,028/- (Rupees Thirteen Lakh Nine Thousand Twenty Eight Only) Bid Increase Amount	admeasuring Residency, K	aring Plot No-100, g 432 sq ft in Rash Kareli, Palsana, Surat	As On Date 30-Jan-2023  Rs. 16,19,411/- (Rupees Sixteen Lakh Nineteen Thousand Four Hundred Eleven Only)		Rs. 7,00,000/- (Rupees Seven Lakh Only)	
	Rs. 20,000/- (Rupees Twenty Thousand Only)	Gujarat 3943 Built up are sq. ft.	ea admeasuring 255			Rs. 70,000/-(Rupees Seventy Thousand Only)	
1.Mr. Jaibhagwan	18-Nov-2021	All that part and parcel of the property bearing Flat No. B-306, measuring 55.74 sq mtrs. Construction area on Third Floor,		Total Outstanding As On Date 02-Jan-2023 Rs. 17,48,129/-		Reserve Price	
Ishwarsingh Malik 2.Mrs. Radhaben	Rs. 13,74,218/- (Rupees Thirteen Lakh Seventy Four Thousand Two Hundred					Rs. 8,50,000/- (Rupees Eight Lakh Fifty Thousand Only)	
Jaykumar Parmar Eighteen Only)		Payal Co-Op. Housing Society Limited, Near Manubhai Tower,					
(Prospect No. 720508)	Reven		evenue Survey No. 453/3 Paiki, Tika No. 8/3, City Curvey No.		housand One	l , , ,	
123300)	Rs. 20,000/- (Rupees Twenty Thousand Only)	90 Paiki ii	n the sim Village asba, Gujarat	Hundred Twenty Nine Only		(Rupees Eighty Five Thousand Only)	
Date	of Inspection of property	EMD Last Date		E-Auction Date & Time			
01-Ms	ar-2023 1100 hrs -1400 hrs		03-Mar-2023	fill 5 nm	06-Ma	r-2023 1100 hrs-1300 hrs.	

Mode Of Payment:- All payment shall be made by demand draft in favour of "IIFL Home Finance Limited" payable at Gurugram or through RTGS/NEFT accounts defails are as follows: a) Name of the Account:- IIFL Home Finance Ltd., b) Name of the Bank:- Standard Chartered Bank, c) Account No 9902879 followed by Loan Number, d) IFSC Code:-SCBL0036001 e) Bank Address: Standard Chartered Bank, 90 M.G. Road, Fort, Mumbai-400001. 1. For participating in e-auction, Intending bidders required to register their details with the Service Provider https://www.bankeauctions.com

well in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM" along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office 2. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the las

5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes.

The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment 4. The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges, land and all other incidental costs, charges including all taxes and rates outgoings relating to the property.

5. Bidders are advised to go through the website https://bankeauctions.com and https://www.iifl.com/home-loans/properties-for-auction fo detailed terms and conditions of auction sale & auction application form before submitting their Bids for taking part in the e-auction sale proceedings
6. For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider E mail ID: support@bankeauctions.com, Support Helpline Numbers:@7291981124/25/26.

For any query related to Property details, Inspection of Property and Online bid etc. call IIFL HFL toll free no.1800 2672 499 from 09:30 hr to 18:00 hrs between Monday to Friday or write to email:- auction.hl@iifl.com. Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of takin

physical possession within 7 days, otherwise IIFL-HFL shall not be responsible for any loss of property under the circumstances. 9. Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law 10. In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled and the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale.

11. AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case of any dispute in tender/Auction, the decision of AO of IIFL-HFL will be final. 15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002

The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost

Place:- Ahmedabad, Date: 15-Feb-2023 Sd- Authorised Officer, IIFL Home Finance Limited

**MEERA INDUSTRIES LIMITED** MEERA CIN: L29298GJ2006PLC048627 INDUSTRIES LIMITED

Regd. Office: Plot No. 2126, Road No.2, G.I.D.C., Sachin-394 230. Surat, Gujarat, India. Website: www.meeraind.com

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED AND NINE MONTH 31ST DECEMBER, 2022

	Consolidated						
Particulars	Three Months Ended			Nine Months Ended		Year Ended	
	31.12.2022 (Un-audited)	30.09.2022 (Un-audited)	31.12.2021 (Un-audited)	7.7.	31.12.2021 (Un-audited)	31.03.2022 (Audited)	
							Total Income from Operations (net)
Net Profit / (Loss) for the period before	200000000000000000000000000000000000000		05618035	WOODERSTEE		95/05/00/05	
exceptional items and tax	(32.37)	(91.60)	126.91	(101.86)	375.99	377.21	
Net Profit / (Loss) for the period before tax	(32.37)	(91.60)	126.91	(101.86)	282.35	377.21	
Net Profit / (Loss) for the period after tax	(40.23)	(80.83)	107.67	(104.51)	283.54	267.07	
Total Comprehensive Income for the	200000000	DHIMBODO	0000000	0.0000000000000000000000000000000000000		10000000	
period (after tax)	(48.74)	(75.12)	108.07	(106.85)	266.55	266.45	
Equity Share Capital	1,067.88	1,067.88	1,067.88	1,067.88	1,067.88	1,067.88	
Other equity (excluding revaluation reserves)						1,547.08	
Earnings Per Share (of Rs. 10/- each) #							
I. Basic	(0.38)	(0.76)	1.01	(0.98)	2.64	2.50	
2. Diluted	111100000000	17.10.000000000000000000000000000000000	1.01	20000	2.64	2.50	
Not Annualised	11.000.000.000	38723328	376036	8000036	62508	1000000	
V = V   V   V   V   V   V   V   V   V	Total Income from Operations (net) Net Profit / (Loss) for the period before exceptional items and tax Net Profit / (Loss) for the period before tax Net Profit / (Loss) for the period after tax Total Comprehensive Income for the period (after tax) Equity Share Capital Other equity (excluding revaluation reserves) Earnings Per Share (of Rs. 10/- each) # I. Basic I. Diluted Not Annualised	Particulars  (Un-audited)  (In-audited)  (In	Particulars   31.12.2022   30.09.2022   (Un-audited)   (Un-audit	Particulars   31.12.2022   30.09.2022   31.12.2021	State   Particulars   31.12.2022   30.09.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2021   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2	State   Particulars   31.12.2022   30.09.2022   31.12.2021   31.12.2022   31.12.2021   31.12.2	

#	Not Annualised	(0.30)	(0.76)	1.01	(0.96)	2.04	2.50		
S	tandalone numbers for the Quarter Ended	31st Decen	nber, 2022						
		Standalone							
SI No.	Particulars	Three Months Ended			Nine Months Ended		Year Ended		
		31.12.2022 (Un-audited)	30.09.2022 (Un-audited)	C-100 - 00 - 00 - 00 - 00 - 00 - 00 - 00	31.12.2022 (Un-audited)	-8000-0-8-0	31.03.2022 (Audited)		
								1	Total Income from Operations (net)
2	Net Profit / (Loss) for the period before tax	(30.31)	(111.91)	95.91	(126.35)	359.00	391.60		
3	Net Profit / (Loss) for the period after tax	(38.16)	(101.16)	76.67	(129.01)	265.36	281.46		
4	Total Comprehensive Income for the period (after tax)	(37.71)	(100.70)	77.07	(127.65)	266.55	280.84		

The Company has adopted Indian Accounting Standards ('Ind AS'), prescribed under Section 133 of the Companies Act; 2013 read

Time adoption of Indian Accounting Standards, have been prepared in accordance with the recognition and measurement principals

with the relevant rules issued thereunder, with effect from April 01, 2020 and accordingly these financial results have been prepared in accordance with Ind AS notified under the Companies (Indian Accounting Standards) Rule, 2015 as amended by the Companies (Indian Accounting Standards) (Amendments) Rules 2016. The Financial results, presented in accordance with Ind AS 101 - First

in Ind AS 34 - Interim Financial Reporting. 2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on

February 13, 2023, same were reviewed by the Statutory Auditor, who have issued an un-modified report thereon. Previous periods figures have been regrouped and rearranged wherever necessary.

Date: 13.02.2023

Place: Surat

The above is an extract of the detailed format of Quarterly/Period Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Period Financial Results are available on the websites of Stock Exchange www.bseindia.com and the Company www.meeraind.com.

For, Meera Industries Limited

Dharmesh Desai

Managing Director

financialexp.epapr.in

Date: 14.02.2023

Place: Ahmedabad



Place:- Surat/ Ahmedabad Date: 15-Feb-2023



Sd/- Authorised Officer, IIFL Home Finance Limited



Ahmedabad